


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ

મ્યુ. સેક્રેટરી ઓફિસ



**PRO ACTIVE DISCLOSURE OF
AHMEDABAD MUNICIPAL CORPORATION'S
MUNICIPAL SECRETARY OFFICE
U/S 4 (1) OF
THE RIGHT TO INFORMATION ACT – 2005**

(Update as on 1st May 2020)

Price : Rs.25/-

અનુકૂળાંકિકા

| ક્રમ | વિગત | પેજ નં |
|------|---|-------------------------------|
| ૧. | પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો | ૧ થી ૪ |
| ૨. | પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો | ૫ |
| ૩. | દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી | ૬ થી ૭ |
| ૪. | પોતાના કાર્યો બજાવવા માટે પોતે નકદી કરેલા ધોરણો | ૮ |
| ૫. | પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો/ વિનિયમો/ સુચનાઓ/ નિયમસંગ્રહો અને રેકર્ડ | ૯ |
| ૬. | પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક | ૧૦ |
| ૭. | તેની નિતી અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજુઆત માટેની વિધમાન કર્ય ગોઈવણાની વિગતો | ૧૧ થી ૧૨ |
| ૮. | તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધ લોકોને મળવાપાત્ર છે કેમ? | ૧૩ થી ૧૪ |
| ૯. | તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા | ૧૫ થી ૧૬ |
| ૧૦. | તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર. | ૧૭ |
| ૧૧. | તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ વહેચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતી તેની દરેક એજન્સી ફાળવેલ અંદાજપત્ર | ૧૮ |
| ૧૨. | ફાળવેલ રકમો અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત | અત્રેના ખાતાને લાગુ પડતું નથી |
| ૧૩. | તેણે આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો | અત્રેના ખાતાને લાગુ પડતું નથી |
| ૧૪. | ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેણે ધરાવેલ માહિતીને લગતી વિગતો | ૧૯ |
| ૧૫. | જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો. | ૨૦ |
| ૧૬. | જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદાઓ અને બીજી વિગતો | ૨૧ |
| ૧૭. | ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી | ૨૨ થી ૨૫ |

પ્રકરણ-૧ (નિયમ સંગ્રહ-૨)

પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો

| વિભાગ/ વ્યવસ્થાતંત્ર | કાર્યો અને ફરજોની વિગતો |
|-------------------------|--|
| મ્યુનિ. બોર્ડ વિભાગ | <p>૧. અ.મ્યુ.કોર્પો.ની મિટીગ માટેના એજન્ડા, નોટીસ માટે સ્ટે.કમિટી, ટ્રાન્સપોર્ટ કમિટી, સ્પે. કમિટીઓ, સભ્યશ્રીઓ તરફથી પુછાયેલા સવાલો, દરખાસ્તો વિગેરે ઉપરથી નોટીસ મેટર તૈયાર કરવી, એજન્ડા તૈયાર કરવાની તમામ કામગીરી કરવી.</p> <p>૨. નોટીસ મેટર જુદા જુદા વર્તમાનપત્રોમાં કમાનુસાર આપવી.</p> <p>૩. અ.મ્યુ.કોર્પો.ના એજન્ડા નોટીસ સભ્યશ્રીઓને યુ.પી.સી. પોસ્ટથી મોકલવા તેમજ એજન્ડા ખાતાઓમાં વહેંચવા, એજન્ડા ફાઈલો તૈયાર કરવી બોર્ડ મીટીગ સમયે સભ્યશ્રીઓના ટેબલ ઉપર મુકવી.</p> <p>૪. મ્યુ. બોર્ડની મિટીગોમાં હાજર સભ્યોની હાજરી લેવી, મતદાન વખતે નામોની નોંધ કરવી, રજસ્ટરમાં હાજરી ખતવવી, માસાંતે સદર હાજરી મીટીગ એલાઉન્સ માટે આપવી.</p> <p>૫. બોર્ડની મિટીગોમાં હાજર રહી નિકાલ થયેલા કામોની નોંધ રાખવી, મ્યુ. બોર્ડમાં આવતા કામોના ઠરાવો તૈયાર કરી સંકલન ખાતે મોકલવા.</p> <p>૬. અ.મ્યુ.કોર્પો.ની મિટીગોની કાર્યવાહીની કાર્યનોંધ રાખવી, સાંકળીયા (ત્રિમાસીક રેકર્ડ) છપાવવા, છપાઈ આવેલ સાંકળીયા મ્યુ.કાઉન્સીલરશ્રીઓ તથા ખાતાઓમાં વહેંચવા.</p> <p>૭. વાર્ષિક વહીવટી અહેવાલ અંગેની માહિતી એકત્ર કરી મ્યુ. સેકેટરી ઓફિસનો વહીવટી અહેવાલ તૈયાર કરવો.</p> <p>૮. જુના રેફરન્સો શોધવા તેમજ મ્યુ. સેકેટરીશ્રી તરફથી વખતોવખત સુચવેલ કામગીરી કરવી.</p> |
| સ્ટે.કમિટી વિભાગ | <p>૧. મ્યુ.કોર્પો.ના જુદા જુદા ખાતાઓ તથા ખાસ સમિતિઓ તરફથી સ્ટેન્ડીગ કમિટીની મંજુરી / નિર્ણય માટે મુકવામાં આવતા કામો સ્વીકારવા.</p> <p>૨. કામોની ચકાસણી કરી પ્રેસી તૈયાર કરી સક્ષમ અધિકારીની મંજુરી મળ્યેથી એજન્ડા તૈયાર કરવો.</p> <p>૩. એજન્ડા તૈયાર થયેથી સંબંધીત હોદેદારશ્રીઓ, સ્ટે.કમિટીના સભ્યશ્રીઓ, તથા મ્યુ. કોર્પો.ના સંબંધીત ખાતાઓમાં પહોંચાડવા</p> <p>૪. સ્ટે.કમિટીમાં રજુ કરવાના તાકીદના કામો તેમજ સભ્યશ્રીઓની દરખાસ્તો તૈયાર કરવી.</p> <p>૫. સ્ટે.કમિટીની મિટીગમાં રજુ થયેલ કામો અંગે થતા નિર્ણય અનુસાર ઠરાવો તૈયાર કરી નકલ સંકલન વિભાગમાં મોકલવી તથા કમિટીનું ગ્રોસીડીગ તૈયાર કરવું.</p> <p>૬. સ્ટે.કમિટીમાં થયેલ ઠરાવોનો રેકર્ડ રાખવો. હોદેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ દ્વારા માંગવામાં આવતા મહત્વના ઠરાવોના રેફરન્સ શોધવા.</p> <p>૭. દફ્તરેની ફાઈલોનું ફેરીસ્ત તૈયાર કરવું.</p> <p>૮. મ્યુ.કોર્પો.ના રેકર્ડ ખાતાના કલાઈને અરજદારશ્રીઓની માંગણી અનુસાર ઠરાવોની નકલો તૈયાર કરવી કમ્પેરીગ કરાવી પૂરી પાડવી.</p> <p>૯. આ ઉપરાંત સ્ટે.કમિટીની સબ કમિટીઓ જેવી કે અપીલ સબ કમિટી તથા ઓડીટ અહેવાલ સબ કમિટીની ઉપરોક્ત દર્શાવ્યા અનુસારની તમામ કાર્યવાહી.</p> <p>૧૦. માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટી તથા મ્યુ. સેકેટરીશ્રી તરફથી વખતોવખત સુચવેલ કામગીરી કરવી.</p> |

| | |
|---|--|
| જુદી જુદી ખાસ સમિતિઓની કામગીરી | <p>૧. ભ્યુ.કોર્પો.ના જુદા જુદા ખાતાઓ તરફથી ખાસ સમિતિઓની મંજુરી / નિર્ણય માટે આવતા કામોની ફાઈલો સ્વીકારવી.</p> <p>૨. આવેલ કામોની ચકાસણી કરી પ્રેસી તૈયાર કરી સબંધિત કમિટીના ચેરમેનશ્રીની સૂચના અનુસાર એજન્ડા બહાર પાડી સમિતિના સભ્યશ્રીઓને તથા જુદા જુદા ખાતાઓમાં એજન્ડા પહોંચાડવો.</p> <p>૩. ખાસ સમિતિઓની મિટીગમાં રજુ થયેલ કામો અંગે થતા નિર્ણય અનુસાર ઠરાવો તૈયાર કરી નકલ સંકલન વિભાગમાં મોકલી આપવી તથા પ્રોસીડીગ તૈયાર કરવુ.</p> <p>૪. આ ઉપરાંત દર ત્રણ મહિને કમિટીનું પ્રોસીડીગ ભ્યુ. બોર્ડમાં મંજુર કરાવવા માટે તૈયાર કરી મોકલવાની કામગીરી કરવી.</p> <p>૫. દફ્તરેની ફાઈલોનું ફેરીસ્ત તૈયાર કરવું.</p> <p>૬. ચેરમેનશ્રી/ડિ.ચેરમેનશ્રીની આવતી ટપાલોને તેમજ નાગરિકો તરફથી આવતી અરજીઓ ઇન્વર્ક કરી સબંધેત ચેરમેનશ્રી સમક્ષ મુક્કી ચેરમેનશ્રીનો શેરો કરાવી જે તે ખાતે મોકલવી.</p> <p>૭. સબંધિત ચેરમેનશ્રીની સૂચના અનુસાર જે તે કમિટીના રાઉન્ડ ગોઠવવામાં આવે તેના સરક્યુલર ની વ્યવસ્થા કરવી.</p> <p>૮. નોન કોરમ રહેલ મીટીગ માટે નવેસરની તારીખ નક્કી કરાવી સરક્યુલરો કરવા તથા કમિટીના સભ્યોને સરક્યુલર પહોંચાડવા.</p> <p>૯. કમિટીના સભ્યશ્રીઓના ઓનેરેરીયમ માટેની હાજરીની વિગત સંબંધિત કલાર્કને આપવી.</p> <p>૧૦. નાગરિકો તરફથી જુદા-જુદા ઠરાવોની નકલ સેન્ટ્રલ રેકર્ડ ખાતા મારફતે માંગણી થાય છે ત્યારે રેકર્ડ કલાર્કની માંગણી અનુસાર રેકર્ડ કાઢી આપી અને માંગણી મુજબના ઠરાવો કખ્પેર કરી તે અંગે આનુષાંગિક કાર્યવાહી કરવી.</p> <p>૧૧. બોર્ડ વિભાગ તરફથી માંગવામાં આવતી કમિટીમાં સહ્યોની હાજરીની વિગતો આપવી.</p> <p>૧૨. તેમજ ભ્યુ. સેકેટરીશ્રી વખતોવખત સુચવેલ કામગીરી કરવી.</p> |
| માન. મેયરશ્રીનું કાર્યાલય | <p>૧. માન. મેયરશ્રી પર નાગરીક લક્ષી ફરીયાદો - પ્રશ્નો અંગે આવતી લેખિત અરજીઓ તથા ટપાલો અંગે માન. મેયરશ્રીની સૂચના અનુસાર જરૂરી ફોલોઅપ સાથે નિકાલ કરવા સબંધિત વિભાગોને મોકલવી.</p> <p>૨. ભ્યુનિસિપલ કમિશનરશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ભ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રજાલક્ષી કામો અંગે સમય સમય પર અને સમયમર્યાદામાં કરવાના થતા જરૂરી પત્રવ્યવહારની કામગીરી કરવી.</p> <p>૩. ભ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશ્નો બાબતમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સાથે ગુજરાતી/અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરવા.</p> <p>૪. ભ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ ઉપરાંત ભ્યુનિ. કમિશનરશ્રી તથા ઉચ્ચ અધિકારીઓ સાથે માન. મેયરશ્રીની મિટીગોનું આયોજન કરવું</p> <p>૫. જુદા જુદા ઉદ્ઘાટન-લોકાર્પણ-ભૂમિપૂજનના કાર્યક્રમોના આયોજન તેમજ મહાનુભાવોની પ્રતિમાઓને પુષ્પાજલી કરવા અંગેના પત્રવ્યવહાર / પરિપત્રો કરવા.</p> <p>૬. માન. મેયરશ્રીની રૂબરૂ મુલાકાતે આવતા નાગરિકો તથા મહાનુભાવોના પ્રશ્નો/ફરિયાદોનો જરૂરી ફોલોઅપ સાથે નિકાલ કરવો.</p> |

| | |
|--|--|
| | <p>૭. દેશ-પરદેશથી આવતા મહાનુભાવો/મહેમાનોના સ્વાગત તેમજ તેઓ સાથેની મિટીગોનું આયોજન કરવું.</p> <p>૮. માન. મેયરશ્રીના કાર્યક્રમો અંગેની ડાયરી મેઈન્ટેઇન કરવી.</p> <p>૯. જુદા જુદા કાર્યક્રમો અંગેના મેયરશ્રીના પ્રવચનો/સુચના મુજબ પ્રેસનોટ તૈયાર કરવી.</p> <p>૧૦. મેયરશ્રીની ઓફીસમાં આવતા ફોન એટેન્ડ કરવા તથા જે તે સુચના અંગે જરૂરી ફોલોઅપ કરવું.</p> <p>૧૧. મેયર ઓફીસને લગતી અન્ય તમામ કામગીરી કરવી.</p> <p>૧૨. મ્યુનિસિપલ બોર્ડ મિટીગની મિનીટ્સ તૈયાર કરવી.</p> |
| ડ્ર્યુટી મેયરશ્રીનું કાર્યાલય | <p>મ્યુ. સેકેટરી ઓફીસમાં માન. ડે.મેયરશ્રીના કાર્યાલયમા સીનીયર કલાર્કની ઓફીસ કામગીરી</p> <p>૧. માન. ડે.મેયરશ્રી ની અંગત મદદનીશની કામગીરી જેવી કે તેમના કાર્યક્રમો વિગેરેની નોંધ કરી ડાયરી તૈયાર કરવી.</p> <p>૨. માન. ડે.મેયરશ્રીની સુચના અનુસાર પત્ર વ્યવહાર તૈયાર કરાવવાની, આઉટવર્ડ રજીસ્ટરમાં નોંધી જે તે ખાતે મોકલવાની તથા ઓફીસ કોપી ફાઈલીંગ કરવાની કામગીરી.</p> <p>૩. માન. ડે.મેયરશ્રી દ્વારા યોજવામાં આવતી પત્રકાર પરિષદ, મ્યુ. અધિકારીશ્રીઓ તથા મ્યુ. કાઉન્સિલરશ્રીઓ સાથે યોજવામાં આવતી મિટીગોના આયોજન અંગેની વ્યવસ્થા કરવી જેવી કે સરક્યુલર બહાર પાડવા તેમજ તેને આનુષાંગિક કાર્યવાહી કરવી.</p> <p>૪. ડે.મેયરશ્રી દ્વારા વખતોવખત સોંપવામાં આવતી કામગીરી.</p> |
| ચેરમેનશ્રી સ્ટેન્ડીંગ કમિટીનું કાર્યાલય | <p>મ્યુ. સેકેટરી ઓફીસમાં માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટીના કાર્યાલયમા સીનીયર કલાર્કની ઓફીસ કામગીરી</p> <p>૧. માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટીની અંગત મદદનીશની કામગીરી જેવી કે તેમના કાર્યક્રમો વિગેરેની નોંધ કરી ડાયરી તૈયાર કરવી.</p> <p>૨. માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટી દ્વારા થતા પત્ર વ્યવહાર તૈયાર કરાવવાની, આઉટવર્ડ રજીસ્ટરમાં નોંધવાની જે તે ખાતે મોકલવાની તથા ઓફીસ કોપી ફાઈલીંગ કરવાની કામગીરી.</p> <p>૩. માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટી દ્વારા યોજવામાં આવતી પત્રકાર પરિષદ, મ્યુ. અધિકારીશ્રીઓ તથા મ્યુ. કાઉન્સિલરશ્રીઓ સાથે યોજવામાં આવતી મિટીગોની જાણ કરવાની તેમજ મિટીગનું આયોજન કરવું.</p> <p>૪. સ્ટે.કમિટીમાં મંજુર થયેલ કામો અને મ્યુ.કોર્પો.ની સામાન્ય સભાની ફાઈલો તૈયાર કરીને ચેરમેનશ્રી સમક્ષ રજૂ કરવાની.</p> <p>૫. મ્યુ. સેકેટરી ઓફીસ દ્વારા તથા માન. ચેરમેનશ્રી સ્ટે.કમિટી દ્વારા વખતો વખત જે કામગીરી સોંપવામાં આવે તેનો અમલ કરવાની.</p> |
| વહીવટી વિભાગ | <p>૧. મ્યુ. સેકેટરી ખાતામાં ફરજ બજાવતાં તમામ અધિકારીઓ /કર્મચારીઓને લગતી વહીવટી કામગીરી જેવી કે પગાર, તમામ પ્રકારની રજાઓ, સર્વિસ બુક નિભાવવાની ઇન્ફીમેન્ટ, નિવૃત થયેલ કર્મચારીઓના નિવૃતિના લાભો અંગેની કામગીરી.</p> <p>૨. ખાતાની ટપાલ વહેંચણી અંગે ઇન્વર્ડ - આઉટવર્ડની કામગીરી.</p> <p>૩. મ્યુ. સેકેટરીશ્રીની જુદી જુદી મેળવેલ મંજુરીઓના ઠરાવોનું રજીસ્ટર, ટેલીફોન રજીસ્ટર, બાર એડવાન્સ રજીસ્ટર વિગેરેના રજીસ્ટરો નિભાવવાની કામગીરી.</p> |

| | |
|--|---|
| | <p>૪. હોદેદારશ્રીઓને ફાળવેલ મોટરકારોનું સંચાલન તથા મરામત અને નિભાવવાની કામગીરી.</p> <p>૫. કન્ટીજન્સી મેળવવા ઈન્ફેન્ટ, તથા ખાતાના બજેટ અંગેની કામગીરી</p> <p>૬. પગારબીલો સિવાયના અન્ય બિલો મ્યુ. કાઉન્સીલરશ્રીઓના ઓનેરેરીયમ, મેડીકલ બિલ, ટેલેફોન બિલ મોબાઈલ બીલ તથા અન્ય જરૂરીયાત મુજબની ખરીદી અંગે મંજુરી મેળવી તેના બિલો બનાવવાની કામગીરી</p> <p>૭. મ્યુ. કોર્પો.ના સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી તથા જરૂર જણાય તો બહારથી સ્ટેશનરી ની ખરીદી કરી જરૂરીયાત મુજબ ખાતાના વિવિધ વિભાગોમાં વહેચણીની કામગીરી.</p> <p>૮. ઈમ્પ્રેશ કેશના બિલો વટાવી કેશ લાવવી.</p> <p>૯. નિમંત્રણો, સરક્યુલરો વગેરે ખાતાના પટાવાળાઓ મારફતે મ્યુ. કાઉન્સીલરશ્રીઓને પહોંચાડવા.</p> <p>૧૦. મ્યુ. સેકેટરી ઓફીસ ખાતે આવેલ હોદેદારશ્રીઓ, ચેરમેનશ્રીઓ, ડે.ચેરમેનશ્રીઓ તથા પક્ષના કાર્યાલયોમાં તેઓની સુચના અનુસારની કામગીરી/ફરજો બજાવવા સારુ પટાવાળા સહિત વર્ગ-૪ના કર્મચારીઓની વ્યવસ્થા કરવાની કામગીરી</p> <p>૧૧. ચૂંટાયેલા હોદેદારશ્રીઓ/માન. મેયરશ્રી/ડે.મેયરશ્રી/ચેરમેનશ્રી સ્ટે.કમિટી/નેતાશ્રી/મ્યુ.સેકેટરીશ્રી તરફથી વખતોવખત સુચવવામાં આવતી કામગીરી</p> |
|--|---|

પ્રકરણ-૨ (નિયમ સંગ્રહ-૨)

પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

ધી બોમ્બે મ્યુ. કોર્પો. એક્ટ -૧૯૪૮ ની કલમ નં. ૪૮ મુજબ મ્યુ. સેકેટરી ઓફિસે વિવિધ ફરજો બજાવવાની હોય છે. જેમાં કોર્પો.ની મિટિંગ સહિત સ્થાયી સમિતિ અને બી. પી. એમ. સી. એક્ટ અનુસાર આવેલ ખાસ સમિતિઓનાં સંચાલનની કામગીરી મ્યુ. સેકેટરી ઓફિસ દ્વારા કરાય છે, જેમાં વહિવટી તંત્ર દ્વારા રજુ થયેલ દરખાસ્તોને જે તે કુભિટી સમક્ષ રજુ કરી તેના અનુસંધાને મિટિંગમાં થતાં નિર્ણય અનુસાર ઠરાવો તૈયાર કરી તેને જરૂરી કાર્યવાહી સારૂ વહીવટી તંત્ર તરફ પાઠવી આપવાની કામગીરી મ્યુ. સેકેટરી ઓફિસ મારફતે થાય છે. સદર કામગીરી ઉપરાંત ઉચ્ચપદાધિકારીશ્રીઓ જેવા કે મેયરશ્રી, ડે. મેયરશ્રી, સ્ટે. કબિટી ચેરમેનશ્રી સહિત અન્ય ઉચ્ચ પદાધિકારીશ્રીઓની કામગીરી તેઓશ્રીની સુચના અનુસાર બજાવવાની થાય છે.

પ્રકરણ-૩

દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ

| | | |
|-----|---|--|
| 3.૧ | જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઈ કાર્યપદ્ધતિ અનુસારવામાં આવે છે? (સચિવાલય નિયમ સંગ્રહ અને કામકાજના નિયમોના નિયમ સંગ્રહ અન્ય નિયમો/વિનિયમો વિગેરેનો સંદર્ભ ટાંકી શકાય) | : જુદા-જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે નિયમો અનુસાર જુદી-જુદી ખાસ સમિતિઓ, સ્થાયી સમિતિ તથા કોર્પોરેશન વિગેરેની બેઠક બોલાવવી બહુમતિએ નિર્ણય લેવા માટે કોર્પોરેશનની સ્થાયી સમિતિ પરિવહન સમિતિ, તથા ખાસ સમિતિઓની કાર્યવાહીનું સંચાલન કરવાના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. |
| 3.૨ | અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપદ્ધતિઓ / ઠરાવેલી કાર્યપદ્ધતિઓ / નિયત માપદંડો / નિયમો કયાં કયાં છે? નિર્ણય લેવા માટે કયાં કયાં સ્તરે વિચાર કરવામાં આવે છે? | અગત્યની બાબતો માટે ખાસ નિર્ણય લેવા માટે પ્રથમ કમિશનરશ્રી લેવલેથી કાર્ય અંગેની દરખાસ્ત આવ્યેથી તે બાબતે નિર્ણય લેવા માટે પરિપત્ર (એજન્ડા) બહાર પાડી બેઠક (મીટિંગ) બોલાવવામાં આવે છે. જેમાં કોર્પોરેશનની સ્થાયી સમિતિ, પરિવહન સમિતિ તથા ખાસ સમિતિઓની કાર્યવાહીનું સંચાલન કરવાના નિયમો તથા ધી જી.પી.એમ.સી. એકટ અન્યથે જુદી જુદી કમિટીઓના સત્તા અંગેના નિયમો મુજબ તથા ધી જી.પી.એમ.સી.એકટની જોગવાઈઓ અનુસાર સ્થાયી સમિતીની બેઠકમાં તથા કોર્પોરેશનની બેઠકમાં ધી જી.પી.એમ.સી. એકટની જોગવાઈઓ મુજબ બેઠક બોલાવી નિર્ણયો કરવામાં આવે છે. આમ ખાસ સમિતિઓ ત્યારબાદ સ્થાયી સમિતિ ત્યારબાદ કોર્પોરેશન સ્તરે વિચારણા કરવામાં આવે છે. |
| 3.૩ | નિર્ણયને જનતા સુધી પહોંચાડવા કઈ વ્યવસ્થા છે ? | વર્તમાનપત્રો, ઈલેક્ટ્રોનિક્સ મીડીયા. |
| 3.૪ | નિર્ણય લેવાની પ્રક્રિયામાં જેના મંતવ્યો લેવાનાર છે. તે અધિકારી કયા છે ? | નિર્ણય લેવાની પ્રક્રિયામાં વિષય સંલગ્ન ખાતાધિકારી, કમિશનરશ્રી |
| 3.૫ | નિર્ણય લેવાનાર અંતિમ સત્તાધિકારી કોણ છે? | ધી જી.પી.એમ.સી. એકટની જોગવાઈ મુજબ કોર્પોરેશને રચેલ ખાસ સમિતિઓ, સ્થાયી સમિતિ, કોર્પોરેશન (બોર્ડ) જે તે લેવલે નિર્ણય લેવાનાર અંતિમ સત્તાધિકારી છે. |

| | |
|--|---|
| ૩.૬ | જે અગત્યની બાબતો પર જાહેર સત્તાવિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. તેની માહિતી અલગ રીતે નીચેના નમુનામાં આપો. |
| ક્રમ નંબર | ઠરાવ આંક |
| જેના ઉપર નિર્ણય લેવાનાર છે તે વિષય | જે તે વિષય સબંધી રજુ થનાર દરખાસ્ત |
| માર્ગદર્શન સુચના/દિશા નિર્દેશ જો કોઈ હોય તો | દરખાસ્તમાં જણાવેલ મંતવ્યો/અભિપ્રાય |
| અમલની પ્રક્રિયા | નિર્ણય થયે પસાર થયેલ ઠરાવ અનુસાર |
| નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અવિકારીઓના હોદ્દા | મ્યુ. કમિશનરશ્રી તથા સંલગ્ન ખાતાના અવિકારીશ્રી |
| ઉપર જણાવેલ અવિકારીઓનાં સંપર્ક અંગેની માહિતી | અમદાવાદ મહાનગરપાલિકા, મુખ્ય કચેરી ઓફિસ. સરાદાર પટેલ ભવન દાણાપીઠ, અમદાવાદ-૧. |
| જો નિર્ણયથી સંતોષ ન હોય તો ક્યાં અને કેવી રીતે અપીલ કરવી | ધી જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈઓ અનુસાર |

પ્રકરણ-૪
પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો

હોદ્દો : ખ્યુ. સેકેટરી

ખ્યુનિસિપલ સેકેટરીની સત્તા અને ફરજો

૪૮. ખ્યુનિસિપલ સેકેટરી કોર્પોરેશનના તેમજ સ્થાયી સમિતિના પણ સેકેટરી રહેશે અને તેમણે -

- (ક) આ અધિનિયમ થી અથવા તે મુજબ તેમને બજાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો હોય તેવી ફરજો ખ્યુ. કોર્પોરેશન અને સ્થાયી સમિતિ અનુકૂળ પોત પોતાના સંબંધી તેને ફરમાવે તેવી બીજી ફરજો બજાવવી.
- (ખ) (૧) કોર્પોરેશન અને કલમ-૩૦ અથવા ઉ૧ મુજબ કોર્પોરેશને નીમેલી કોઈપણ સમિતિની,
(૨) સ્થાયી સમિતિ અને તેની કોઈપણ પેટા સમિતિની કાર્યવાહીઓ સાથે સંબંધ ધરાવતા સઘળા કાગળો અને દસ્તાવેજો કસ્ટડીમાં રાખવા.
- (ગ) સ્થાયી સમિતી વખતો વખત કરે તેવા નિર્દેશનોને આધિન રહીને તેના સીધા તાબા હેઠળના અધિકારીઓ અને નોકરોની ફરજો ઠરાવવી અને
- (ઘ) સ્થાયી સમિતિના હુકમોને આધિન રહીને, સદરહુ અધિકારીઓ અને નોકરોના કાર્યો અને કાર્યવાહીઓ ઉપર ટેખરેખ અને નિયંત્રણ રાખવું અને વિનિયમોને આધિન રહીને સદરહુ અધિકારીઓ અને નોકરોની નોકરી, મહેનતાણું અને વિશેષાધિકારોને લગતા પ્રશ્નોનો નિકાલ કરવો.
- (ચ) સેન્ટ્રલ ઓફિસ ઓફિસ ઓર્ડર નં ૩૫ તા.૧૦-૯-૨૦૦૮ અનુસાર ખ્યુ. કમિશનરશ્રીની તા.૯-૯ ૨૦૦૮ની મળેલ મંજુરી અનુસાર ખ્યુ. સેકેટરી ઓફિસના અપીલ અધિકારી તરીકેની ફરજો

પ્રકરણ-૫

**પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના
અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા
નિયમો/વિનિયમો/સુચનાઓ/નિયમસંગ્રહો અને રેકર્ડ**

| <u>દસ્તાવેજનું નામ / મથાળું</u> | <u>અન્ય</u> |
|--|---|
| દસ્તાવેજ પરનું ટુંકુ લખાશ | પ્રોસીડિંગ (બોર્ડ, જુદી જુદી સમિતિઓની કાર્યવાહી બુક) |
| વક્તિને નિયમો, વિનિયમો, સુચનાઓ નિયમસંગ્રહ મેળવવા અંગે | સેન્ટ્રલ રેકર્ડ ખાતેથી નિયત ફી ભરવાથી નકલ મળશે. |
| વિભાગ દ્વારા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને દફ્તરોની નકલ માટે લેવાની ફી (જો હોય તો) | ધી ગુજરાત પ્રવિન્સીયલ ઘુનિસિપલ કોર્પોરેશન એકટના અનુસુચિ-ક (A) પ્રકરણ ૨-જુ કોર્પોરેશન સ્થાયી સમિતિ, વાહન વ્યવહાર સમિતિ વિગેરેની કાર્યવાહીઓનું નિયમન કરતી જોગવાઈઓ પૈકી જોગવાઈ ૧(થ)(N) તથા અ.મ્યુ.કોર્પો.ના મેન્યુઅલ- ૧ નિયમો પ્રકરણ-૨ના નિયમ ૧(એન) મુજબ મ્યુ.કોર્પો.ની કાર્યવાહીની નોંધ તથા સદર મેન્યુઅલ-૧ના (ક) ખાસ સમિતિઓની રચના અને તેની કાર્યવાહીની નોંધના નિયમ ૭(પ)મુજબ મ્યુ.કોર્પો તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ કોર્પોરેશનની મુખ્ય કયેરીમાં ઓફીસ સમય દરમ્યાન કોઈ પણ યોગ્ય સમયે કોઈપણ મ્યુ.કાઉન્સીલરશીને ચાર્જ ભર્યા વિના જોવા માટે ખુલ્લી રહેશે. જ્યારે અન્યને પચાસ પૈસાની ફી આપ્યેથી જોવા માટે મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયમાં સઘળા વાજબી વખતે ખુલ્લી હોવી જોઈએ તે અનુસાર કોઈપણ વ્યક્તિ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન, સ્ટેન્ડિંગ કમિટી તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ અગાઉથી જાણ કરી એકટની જોગવાઈ અનુસાર નિયત ફી ભરીને જોઈ શકશે પરંતુ ઠરાવની નકલ મેળવવા માટે સેન્ટ્રલ રેકર્ડ ખાતા દ્વારા નિયત ફી ભર્યેથી ઠરાવની નકલ પ્રાપ્ત થશે રોજકામની કાયદા વિષયક બાબતો મ્યુ.કાઉન્સીલરો સિવાય અન્ય કોઈ વ્યક્તિ માટે ખુલ્લી રખાતી નથી. |

પ્રકરણ- ૬

પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

- (૧) વહીવટીતંત્ર દ્વારા રજુ થયેલ દરખાસ્તો મ્યુ. કોર્પો. બોર્ડ, સ્ટેન્ડિંગ કમિટી તથા જુદી જુદી ખાસ સમિતિઓ સમક્ષ રજુ કરી તેના અનુસંધાને મિટીગમાં થતા નિર્ણય અનુસાર થયેલ ઠરાવો જરૂરી કાર્યવાહી સારુ વહીવટીતંત્ર તરફ પાઠવી તેની નકલ તથા પ્રોસીડીઝ્સ મ્યુ. સેકેટરી ખાતાના નિયંત્રણ હેઠળ રાખવામાં આવે છે.
- (૨) મ્યુ. સેકેટરી ખાતામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ / કર્મચારીઓનું વહીવટી રેક્રિ

પ્રકરણ-૭

૭.૧ તેની નિતી અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સત્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજુઆત માટેની વિધમાન કઈ ગોઠવણાની વિગતો

નીતિ ઘડતર

| અ.નં. | વિષય / મુદ્દો | શું જનતાની સહભાગીતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે? | જનતાની સહભાગીતા મેળવવા વ્યવસ્થા માટેની |
|-------|---|---|---|
| ૧. | નીતિ ઘડતર અથવા નીતિના અમલ સબંધી કભિશનરશ્રી તરફથી રજુ થતી દરખાસ્તો | ના | ના પરંતુ, જનતા દ્વારા ચુંટીને મોકલેલ તેમના પ્રતિનિધિઓનું (શ્રીપર્ટેર / કાઉન્સીલરો) બોર્ડની રચના ધી જી.પી.એમ.સી. એકટ મુજબ થાય છે. આ બોર્ડ દ્વારા ધી જી. પી. એમ. સી. એકટની જોગવાઈઓ અનુસાર સ્થાયી સમિતિ તથા ખાસ સમિતીઓની રચના કરવામાં આવે છે. આમ બોર્ડ, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓ તેમની સમક્ષ રજુ થતી નીતિ ઘડતર અથવા નીતિના અમલ સબંધી કભિશનરશ્રી તરફથી આવેલ દરખાસ્તો અંગે નિર્ણયો કરે છે. |

* આનાથી નાગરીકને કયા આધારે નીતિ વિષયક બાબતોનાં ઘડતર અને અમલમાં જનતાની સહભાગીતા નક્કી કરાઈ છે તે સમજવામાં મદદ થશે.

પ્રકરણ-૭

૭.૨ તેની નિતી અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સહ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજુઆત માટેની વિધમાન કઈ ગોઠવણની વિગતો

નીતિ અમલ :

| અ.નં. | વિષય / મુદ્દો | શું જનતાની સહભાગીતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે? | જનતાની સહભાગીતા મેળવવા વ્યવસ્થા માટેની |
|-------|---|---|--|
| ૧. | નીતિ અમલ માટે જનતાની અથવા તેમના પ્રતિનિધિઓની સલાહ / પરામર્શ / સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા | ના | ના પરંતુ, જનતા દ્વારા ચુંટીને મોકલેલ તેમના પ્રતિનિધિઓનું (ક્રોર્પોરેટર / કાઉન્સિલરો) બોર્ડની રચના ધી જી.પી.એમ.સી. એકટ મુજબ રચાય છે. આ બોર્ડ તેમના કાર્યો કરવા માટે ધી જી. પી. એમ. સી. એકટની જોગવાઈઓ અનુસાર સ્થાયી સમિતિની રચના કરે છે. બોર્ડ, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓની મીટિંગો મળતી હોય છે તેમાં અવાર-નવાર નક્કી થયેલ નીતિઓની અમલવારી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. |

પ્રકરણ-૮

તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ,
કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની
કાર્યનોંધ લોકોને મળવાપાત્ર છે કે કેમ ?

૮.૧ : જાહેર તંત્રને બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય મંડળો અંગેની વિગત નીચેના નમૂનામાં
આપો.

| | |
|--|---|
| માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું | અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન સરદાર પટેલ ભવન, દાખાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧ |
| માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો) | કોર્પોરેશન (બોર્ડ) |
| માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટૂંકો પરિચય (સંસ્થાની સ્થાપના વર્ષ / મુખ્ય પ્રવૃત્તિઓ / ઉદ્દેશ) | સને ૧૮૭૪ માં શહેર સુધરાઈની સ્થાપના બાદ સને ૧૮૫૮ થી કાયદેસર મુનિસિપાલીટીની શરૂઆત થઈ. સને ૧૮૫૦ માં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની રચના થઈ. શહેરના લોકોને પાયાની સુવિધાઓ અને સુખાકારી પુરી પાડવાના કાર્યો જેવા કે પાણી, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, રસ્તા, વીજળી, બગીચા. |
| માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા (સલાહકાર સંચાલક / કાર્યકારી / અન્ય) | સંચાલક |
| માળનું અને સત્ય બંધારણ | ધી ગુજરાત પ્રોવિન્સીયલ મુનિસિપલ કોર્પોરેશન એક્ટ (અધિનિયમ) ૧૯૪૮ તથા નામદાર સરકારશ્રીના વખતો વખતના આદેશોને આવિન. |
| સંસ્થાના વડા | મેયરશ્રી, સ્ટેન્ટીંગ કમિટી ચેરમેનશ્રી, મ્યુ. કમિશનરશ્રી |
| મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામા | અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન ત્રીજો માળ, સી બ્લોક, સરદાર પટેલ ભવન, દાખાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧ |
| બેઠકની સંખ્યા | મ્યુ.કાઉ.બેઠકોની સંખ્યા - ૧૯૨ ઇલેક્શન વૉર્ડની સંખ્યા - ૪૮ |

| | |
|--|--|
| | <p>શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે ?</p> <p>ના, પરંતુ, દરેક સભા જાહેર જનતા માટે ખુલ્લી રહેશે. સિવાય કે સભામાં હાજર હોય તેવા સદ્યથો બહુમતીથી ઠરાવ પસાર કરીને એવો નિર્ણય કરે કે મહાનગરપાલિકા સમક્ષ ચાલુ હોય એવી કોઈપણ બાબત, ચોક્સાઈ અથવા વિચારણા એવી છે કે તે ખાનગીમાં કરવી જોઈએ. આવો ઠરાવ અધ્યક્ષ સ્થાન લેનાર પોતાની મેળે અથવા સભામાં હાજર હોય એવા કોઈપણ સદ્યથોની વિનંતી પરથી અગાઉ ચર્ચા કર્યા સિવાય રજુ કરવો જોઈએ. આ ઉપરાંત પ્રેક્ષક કક્ષના પ્રવેશનું નિયમન નીચે મુજબ કરવામાં આવશે.</p> <p>મહાનગરપાલીકાના સેકેટરી તરફથી દરેક સભ્યને તેમના મહેમાન માટે પ્રેક્ષક કક્ષમાં પ્રવેશ આપવા માટે સભાના એક કલાક અગાઉથી સભાગૃહની પ્રેક્ષક કક્ષની બેઠક સંખ્યાની મર્યાદામાં દરેક સદ્યને સરખી સંખ્યામાં પાસ આપવામાં આવશે. પ્રેક્ષક કક્ષની બેઠકો માટેના પ પ્રવેશ પત્રો મેયરશ્રીના મહેમાનો માટે અનામત રહેશે. જો પાસ માટેનો ધસારો વધારે હશે તો પ્રવેશ પત્રોનો સમય એક કલાક પુરતો મર્યાદિત રહેશે.</p> <p>જો કોઈપણ મુલાકાતી સભાના કામકાજને ખલેલ પહોંચાડશે તો સભાપતિ તેમને પ્રેક્ષક કક્ષ ખાલી કરીને તાત્કાલીક ચાલ્યા જવા નિર્દેશ કરે તો મુલાકાતીએ તે મુજબ ચાલ્યા જવું પડશે. મુલાકાતી તેમ નહીં વર્તે તો મેયર અગાર તો અધ્યક્ષસ્થાન લેનાર સભ્ય તેમને દૂર કરવા માર્શિલને આદેશ આપશે.</p> |
| | <p>શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે ?</p> <p>હા, કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે.</p> |
| | <p>બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે ?</p> <p>ધી ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટના અનુસૂચિ-ક (A) પ્રકરણ ૨-જુ કોર્પોરેશન સ્થાયી સમિતિ, વાહન વ્યવહાર સમિતિ વિગેરેની કાર્યવાહીઓનું નિયમન કરતી જોગવાઈઓ પૈકી જોગવાઈ ૧(થ)(N) તથા અ.મ્યુ.કોર્પો.ના મેન્યુઅલ-૧ નિયમો પ્રકરણ-૨ના નિયમ ૧(એન) મુજબ મ્યુ.કોર્પો.ની કાર્યવાહીની નોંધ તથા સદર મેન્યુઅલ-૧ના (ક) ખાસ સમિતિઓની રચના અને તેની કાર્યવાહીની નોંધના નિયમ ૭(પ)મુજબ મ્યુ.કોર્પો તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં ઓફીસ સમય દરમ્યાન કોઈ પણ યોગ્ય સમયે કોઈપણ મ્યુ.કાઉન્સીલરશ્રીને ચાર્જ ભર્યા વિના જોવા માટે ખુલ્લી રહેશે. જ્યારે અન્યને પચાસ પૈસાની ફી આપ્યેથી જોવા માટે મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયમાં સધળા વાજબી વખતે ખુલ્લી હોવી જોઈએ તે અનુસાર કોઈપણ વ્યક્તિ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન, સ્ટેન્ડીંગ કમિટી તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ અગાઉથી જાણ કરી એકટની જોગવાઈ અનુસાર નિયત ફી ભરીને જોઈ શકશે પરંતુ ઠરાવની નકલ મેળવવા માટે સેન્ટ્રલ રેકર્ડ ખાતા દ્વારા નિયત ફી ભર્યેથી ઠરાવની નકલ પ્રાપ્ત થશે રોજકામની કાયદા વિષયક બાબતો મ્યુ.કાઉન્સીલરો સિવાય અન્ય કોઈ વ્યક્તિ માટે ખુલ્લી રખાતી નથી.</p> |

પ્રકરણ-૮

તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તકા

મ્યુનિસિપલ સેકેટરીની ઓફીસ

નામ અને હોટ્ટો

ટેલિફોન નંબર
ઓફીસ/ એક્ટેન્શન નં

શ્રી અરૂપભાઈ આર. પંડ્યા
મ્યુનિસિપલ સેકેટરી

૨૫૩૮૭૭૭૮
૨૫૩૮૧૮૧૧/૬૦૭
૮૩૭૬૦ ૧૮૪૮૮

શ્રી રથિન ભવું
પી.એસ. ટુ મેયર(જગ્યા ખાલી)
જુ.કલાર્ક શ્રી રથિન ભવું ને ચાર્જ સૌપેલ છે

૨૫૩૨૮૦૦૮
૨૫૩૮૧૮૧૧/૬૦૧/૬૦૪

શ્રી અનિલ જોધાણી
પી.એસ. કમ પી.આર.ઓ.ટુ
ચેરમેન-સ્ટે.કમિટી

૨૫૩૮૧૮૧૧/૬૦૬/૬૦૮
૮૩૨૭૫૪૫૮૦૮

શ્રી દિનેશભાઈ જોધી
પી.એ. ટુ ડેપ્યુટી મેયર


૨૫૩૮૧૮૧૧ / ૬૦૪ / ૪૮૧

શ્રી મનોજભાઈ ગામેતી
ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ

૨૫૩૮૧૮૧૧ / ૪૨૭

પ્રકરણ-૮

તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તકા



: ૧૬ :

પ્રકરણ-૧૦

તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પધ્યતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર.

| અ.નં. | હોદ્દો | શીડયુલ પરની જગ્યાની સંખ્યા | મે-૨૦૨૦ એક અધિકારી /કર્મચારીને માસિક ચુકવાતુ મહેનતાણું |
|-------|---------------------------------------|----------------------------|--|
| ૧. | મ્યુ. સેકેટરી | ૧ | ૨,૨૧,૬૮૩ |
| ૨. | ડે.મ્યુ.સેકેટરી | ૧ | જગ્યા ખાલી |
| ૩. | પી. એસ. ટુ. મેયર | ૧ | જગ્યા ખાલી |
| ૪. | પી. એસ. કમ સ્ટેનો ટુ મેયર | ૧ | જગ્યા ખાલી |
| ૫. | સ્ટેનોગ્રાફર (ગુજરાતી) | ૧ | જગ્યા ખાલી |
| ૬. | ટાઇપીસ્ટ કમ કલાર્ક | ૪ | ૮૭,૫૪૭ |
| ૭. | ઓફિસ સુપ્રિ (વેલ્યુઅશન ઓફીસર કક્ષાના) | ૪ | ૭૮,૦૫૮ |
| ૮. | પી.એસ. કમ પી. આર. ઓ. ટુ સ્ટે. કમિટી | ૧ | ૧,૧૩,૭૦૦ |
| ૯. | હેડ કલાર્ક કક્ષાના | ૭ | ૭૭,૮૩૪ |
| ૧૦. | સીની. કલાર્ક | ૧૩ | ૭૫,૬૧૭ |
| ૧૧. | જુની. કલાર્ક | ૩ | ૬૦,૦૧૭ |
| ૧૨. | હેડ ડ્રાઈવર કમ મીકેનીક | ૧ | ૬૪,૨૪૧ |
| ૧૩. | ડ્રાયવર | ૨૪ | ૬૧,૬૧૩ |
| ૧૪. | નાયક | ૫ | ૪૪,૬૮૪ |
| ૧૫. | પટાવાળા | ૩૮ | ૫૦,૩૮૫ |
| ૧૬. | લેડી એટેન્ડન્ટ | ૨ | જગ્યા ખાલી |
| ૧૭. | કલીનર | ૩ | જગ્યા ખાલી |
| ૧૮. | એટેન્ડન્ટ | ૪ | ૩૮૭૮૨ |
| | | ૧૧૫ | |

પ્રકરણ-૧૧

**તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ વહેચણી પરના અહેવાલોની વિગતો
દર્શાવતી તેની દરેક એજન્સી ફાળવેલ અંદાજપત્ર**

મ્યુ. સેકેટરી ઓફિસના બજેટ હેડ વર્ષ ૨૦૨૦-૨૦૨૧

| અ.નં. | બજેટ હેડ | કોડ નં. | મંજુર થયેલ રકમ (રૂ. લાખમાં) |
|-------|--|---------|--------------------------------|
| ૧. | પગાર ખર્ચ | ૩૦૧૫૫ | ૩૧૧.૬૨ |
| ૨. | ટેલીફોન બીલ (રહેઠાણ) | ૩૦૩૦૨ | ૦.૫૦ |
| ૩. | મેડિકલ ખર્ચ (કાઉન્સીલર માટે) રીએમ્બર્સમેન્ટ | ૩૦૩૦૮ | ૨૫.૦૦ |
| ૪. | યુનિફોર્મ | ૩૦૪૦૧ | ૩.૦૦ |
| ૫. | ટેલીફોન તથા ટ્રન્કાલ ઓફિસ માટે | ૩૪૧૦૧ | ૩૫.૦૦ |
| ૬. | પોસ્ટેજ તથા ટેલીગ્રામ | ૩૪૧૦૨ | ૨.૦૦ |
| ૭. | ઓલ ઈન્ફીયા કાઉન્સીલ ઓફ મેયર્સની વાર્ષિક સભાસદ ફી | ૩૪૨૧૫ | ૦.૫૦ |
| ૮. | સ્ટેશનરી | ૩૪૪૦૧ | ૬.૦૦ |
| ૯. | કોમ્પ્યુટર સ્ટેશનરી | ૩૪૪૦૨ | ૨.૦૦ |
| ૧૦. | પ્રિન્ટીંગ | ૩૪૪૦૪ | ૭.૬૫ |
| ૧૧. | એરોક્ષસ | ૩૪૪૦૫ | ૨.૫૦ |
| ૧૨. | વાર્ષિક મહોત્સવ, તહેવારો, ઉજવણી પ્રસંગો | ૩૪૭૦૧ | ૩૫.૦૦ |
| ૧૩. | સ્મૃતિ ચિન્હો, (મોમેન્ટો) - નેમપ્લેટસ | ૩૪૭૦૨ | ૦.૨૦ |
| ૧૪. | મેયરશ્રી નગર રત્ન એવોર્ડ | ૩૪૭૧૫ | ૨૫.૦૦ |
| ૧૫. | જાહેર ખબર તથા પબ્લિસિટી | ૩૪૮૦૧ | ૧૦.૦૦ |
| ૧૬. | મ્યુ. કાઉન્સીલરશ્રીઓના ઓનેરેરીયમ તથા ભથ્થાઓ | ૩૪૮૦૩ | ૪૨૫.૦૦ |
| ૧૭. | કમિટીના ખર્ચ | ૩૪૮૦૪ | ૨.૦૦ |
| ૧૮. | પુસ્તકો, અખભારો, સામાચિકો, રમકડા | ૩૪૮૦૮ | ૦.૬૦ |
| ૧૯. | જુના દસ્તાવેજો ના કોમ્પ્યુટરાઈઝેશનનું તથા માઈકો ફીલ્મીંગ અંગેનું ખર્ચ | ૩૪૮૧૬ | ૫.૦૦ |
| ૨૦. | ડીસ્કિશનલ કન્ટીઝન્સી | ૩૪૮૨૦ | ૫૦.૦૦ |
| ૨૧. | અન્ય ખર્ચ | ૩૪૮૫૫ | ૧૪.૦૦ |
| ૨૨. | સંદેશા વ્યવહારના સાધનો, ટેલીફોન, વાયરલેસ | ૩૮૭૦૭ | ૧.૪૦ |
| ૨૩. | એરકન્ટીશનર, એરકુલર્સ, રેફીજરેટર્સ તથા વોટર કુલર્સ | ૩૮૭૦૮ | ૩.૦૦ |
| ૨૪. | મોટરકાર તથા જીપ | ૩૮૮૦૧ | ૨૦.૦૦ |
| ૨૫. | ટેબલ તથા ખુરશી, બાંકડા, બેન્ચ | ૩૯૦૦૧ | ૧.૦૦ |
| ૨૬. | અન્ય વિજણી ખર્ચ (લાઈટ એનજી) | ૪૩૧૦૨ | ૨.૫૦ |
| ૨૭. | વહીવટી સુધારણા, તપાસ, સંશોધન તથા જાહેર લોકમતના ખર્ચ | ૪૮૪૦૫ | ૭૫.૦૦ |
| | કોપોરેશન કમિટી તથા સેકેટરી ની ઓફિસ - કુલ | | ૧૦૬૮.૫૭ |

નોંધ :- ઉપરોક્ત વિગતો નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ મુજબ છે.

પ્રકરણ-૧૪

ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેણે ધરાવેલ માહિતીને લગતી વિગતો

- (૧) વહીવટીતંત્ર દ્વારા રજુ થયેલ કામો મ્યુ. કોર્પો. બોર્ડ, સ્ટેન્ડીંગ કમિટી તથા જુદી જુદી ખાસ સમિતિઓ સમક્ષ રજુ કરી તેના અનુસંધાને મિટીગમાં થતા નિર્ણય અનુસાર પસાર થયેલ ઠરાવો ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં ઉપલબ્ધ હોય તે જ સને જુલાઈ -૨૦૦૧ થી અમલમાં છે. પરંતુ પ્રો એક્ટીવ ડીસ્કલોઝરના મુદ્દા નંબર ૧૫ અનુસાર ઠરાવની નકલ મ્યુ. કોર્પો. ની સ્ટેન્ડીંગ કમિટીની મિટીગના ઠરાવ નંબર ૫ તારીખ ૩-૪-૧૯૮૮ તથા મ્યુ. કોર્પો. ઠરાવ નંબર ૪૬ તા. ૨૨-૪-૧૯૮૮ અનુસાર મ્યુ. કોર્પો. ના સેન્ટ્રલ રેકર્ડ ખાતા દ્વારા મેળવવાની રહેશે.
- (૨) માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪ અંતર્ગત પ્રોએક્ટીવ ડીસ્કલોઝર (સ્વયં જાહેર કરવાની બાબતો) મ્યુ. સેકેટરી ઓફિસને લગતી તા. ૧-૫-૨૦૧૮ ની સ્થિતિએ અધતન કરી ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં સમાવાયેલ છે તથા મ્યુ. કોર્પો. ની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

પ્રકરણ-૧૫

જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો.

| | | |
|------|---|---|
| ૧૫.૧ | <p>લોકોને માહિતી મળે તે માટે વિભાગે અપનાવેલ સાધનો, પદ્ધતિઓ અથવા સવલતો ની વિગત</p> | <p>દી ગુજરાત પ્રવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના અનુસુચિ-ક (A) પ્રકરણ ૨-જુ કોર્પોરેશન સ્થાયી સમિતિ, વાહન વ્યવહાર સમિતિ વિગેરેની કાર્યવાહીઓનું નિયમન કરતી જોગવાઈઓ પૈકી જોગવાઈ ૧(થ)(N) તથા અ.મ્યુ. કોર્પો.ના મેન્યુઅલ- ૧ નિયમો પ્રકરણ-૨ના નિયમ ૧(એન) મુજબ મ્યુ.કોર્પો.ની કાર્યવાહીની નોંધ તથા સદર મેન્યુઅલ- ૧ના (ક) ખાસ સમિતિઓની રચના અને તેની કાર્યવાહીની નોંધના નિયમ ૭(પ)મુજબ મ્યુ.કોર્પો તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં ઓફીસ સમય દરમ્યાન કોઈ પણ યોગ્ય સમયે કોઈપણ મ્યુ.કાઉન્સીલરશીને ચાર્જ ભર્યા વિના જોવા માટે ખુલ્લી રહેશે. જ્યારે અન્યને પચાસ પૈસાની ફી આપેથી જોવા માટે મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયમાં સઘળા વાજબી વખતે ખુલ્લી હોવી જોઈએ તે અનુસાર કોઈપણ વ્યક્તિ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન, સ્ટેન્ડીંગ કમિટી તથા ખાસ સમિતિઓની કાર્યવાહીની નોંધ અગાઉથી જાણ કરી એક્ટની જોગવાઈ અનુસાર નિયત ફી ભરીને જોઈ શક્શે પરંતુ ઠરાવની નકલ મ્યુ.કોર્પો.ની સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગના ઠરાવ નંબર ૫ તા.૩-૪-૧૯૮૮ તથા મ્યુ. કોર્પો. ઠરાવ નંબર ૪૬ તા.૨૨-૪-૧૯૮૮ અનુસાર મ્યુ. કોર્પો.ના સેન્ટ્રલ રેકર્ડ ખાતા દ્વારા મેળવવાની રહેશે.</p> |
| ૧૫.૨ | <p>માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ ૪ અંતર્ગત પ્રો-એક્ટીવ ડિસ્કલોગર (સ્વયં જાહેર કરવાની બાબતો) મ્યુ. સેકેટરી ઓફીસને લગતી તા.૧-૫-૨૦૧૯ ની સ્થિતિએ અધ્યતન કરવામાં આવેલ છે.</p> | <p>નાગરિકોની જાણ માટે મ્યુ. કોર્પો.ની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.</p> |

જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદાઓ અને બીજી વિગતો

ભ્યુ. સેકેટરી ઓફીસ

અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ, ત્રીજો માણ, સરદાર પટેલ ભવન, દાખાપઠ,
ગોળલીમડા, અમદાવાદ.

ઓફિસ સમય : સવારે ૧૧-૩૦ થી સાંજે ૭-૧૦

રિસેસ : બપોરે ૨-૦૦ થી ૨-૩૦

શ્રી અરૂપા આર. પંડ્યા
ભુનિસિપલ સેકેટરી અને અપીલ અધિકારી

ટેલીફોન નંબર :

૨૫૭૫૨૫૭૫
૨૫૭૯૯૯૯૯/૬૦૭
(મો.) ૯૮૭૬૦૯૮૫૮૮

શ્રી મનોજભાઈ વી. ગામેતી
ઓફિસ સુપ્રિટેન્ડન્ટ અને જાહેર માહિતી અધિકારી

ટેલીફોન નંબર :

૨૫૭૯૯૯૯૯/૪૨૭ મો. નં. ૮૫૭૭૬૬૪૮૧

ભ્યુ. સેકેટરી ઓફીસ, અમદાવાદ ભ્યુ. કોર્પોરેશન,
મહાનગર સેવા સંદર્ભ, સી બ્લોક, ત્રીજો માણ, સરદાર પટેલ ભવન, દાખાપઠ,
ગોળલીમડા, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

ચૂંટાયેલી પાંખ

મેયર

ડેપ્યુટી મેયર

સ્ટેન્ડીંગ કમિટી

વોટર સાખાય એન્ડ સુઅરેજ કમિટી

મ્યુ. ટ્રાન્સપોર્ટ કમિટી

રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી

હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી

મ્યુનિસિપલ સ્કુલબોર્ડ

હોસ્પિટલ કમિટી

સ્ટાફ સીલેક્શન એન્ડ
એપોઇન્ટમેન્ટ કમિટી

રીકીએશનલ, કલ્યાલ એન્ડ હેરીટેજ કમિટી

ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી

હાઉસીંગ, ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ઈ.ડબલ્યુ.એસ.
આવાસ યોજના કમિટી

લીગલ કમિટી

રેવન્યુ કમિટી

મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી

મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટી

પ્રકરણ-૧૭
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી ચુંટાયેલા હોદેદારો, પક્ષના કાર્યાલયો

| નામ અને હોદો | ઓફીસ | એક્ટે. | રહેણાથ / મોબાઇલ |
|--|----------------------------|-------------------|---|
| શ્રી જિજલનેન આર. પટેલ મેયરશ્રી | ૨૫૩૨૮૦૦૯ ફેક્સ ૨૫૩૫૮૮૮૮ | ૬૦૧ ૬૦૪ ૪૦૩ | ૨૬૪૬૩૪૪૫ (મેયર બંગાલો) ૯૩૨૭૪૨૬૦૧૯ |
| શ્રી દિનેશભાઈ કે. મકવાણા ડ.મેયરશ્રી | ૨૫૩૫૪૩૨૨ | ૬૦૫ ૪૮૧ | ૯૩૨૭૪૨૬૦૭૪ |
| શ્રી અમુલભાઈ બી. ભંડ ચેરમેનશ્રી - સ્ટેન્ડોગ કમિટી | ૨૫૩૫૪૪૨૪ ફેક્સ ૨૫૩૫૮૬૮૮ | ૬૦૬ ૬૦૮ ૭૨૮ | ૯૮૨૫૦૧૩૧૨૬ |
| શ્રી રાજેશભાઈ પી. ઠાકોર દંકશ્રી | ૨૫૩૮૯૮૧૧ | ૮૦૪ | ૯૯૨૫૦૨૨૭૭૫ |
| શ્રી અમિતભાઈ પી. શાહ નેતાશ્રી, ખ્રુ. ભા.જ.પ. | ૨૫૩૫૦૮૭૬ | ૬૧૦ | ૯૮૨૫૬૦૦૪૮૬ |
| શ્રી દિનેશભાઈ એસ. શર્મા નેતાશ્રી - ખ્રુ. કોંગ્રેસ | ૨૫૩૮૯૮૧૧ ફેક્સ ૨૫૩૫૪૪૬૩ | ૪૦૧ ૭૦૮ | ૯૬૮૭૬૭૮૮૮૮ ૯૮૨૫૦૦૮૩૪૩ |
| ભારતીય જનતા પક્ષ કાર્યાલય | | | |
| <p>કાર્યાલય મંત્રી : ખ્રુ.ભા.જ.પ (૧) શ્રી પ્રશાંત કાપડીયા મો. નં. ૦૭૯-૨૫૩૮૯૮૧૧/૪૦૩ (૨) શ્રી અનિલ ભગત મો.નં.: ૯૮૨૭૪ ૨૬૧૩૦ ફોન નં. ૨૫૩૮૯૮૧૧ એક્ટે. ૫૦૨, ૫૦૩, ૫૦૪, ૫૦૫, ૫૦૮, ૫૧૨, ૫૧૩, ૬૦૨, ૬૨૧,૯૪૫</p> | | | |
| <p style="text-align: center;">કોંગ્રેસ પક્ષ કાર્યાલય</p> <p>કાર્યાલય મંત્રી : -શ્રી નવનીતલાલ શાહ મો. નં. ૯૮૨૭૪ ૨૬૧૩૧ ફોન નં. ૨૫૩૮૯૮૧૧ એક્ટે. ૪૫૧, ૪૫૨, ૪૫૩, ૪૦૫, ૭૧૪, ૭૫૧, ૭૫૨</p> | | | |

પ્રકરણ-૧૭
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી
મ્યુનિસિપલ કોર્પો.ની વિવિધ ખાસ કમિટીઓના ચેરમેનશ્રીઓની યાદી

| ચેરમેનશ્રીનું નામ / કમિટીનું નામ | ઓફિસ ફોન નંબર | એક્ટે. | મોબાઇલ નંબર |
|--|---------------|--------|--------------------------|
| શ્રી અતુલભાઈ સી. ભાવસાર ચેરમેનશ્રી - ટ્રાન્સપોર્ટ કમિટી | ૨૫૩૫૨૨૩૪ | | ૯૯૧૩૭૧૪૧૧ |
| શ્રી રશ્મીકાન્ત એન. શાહ વોટર સપ્લાય એન્ડ સુઆરેજ કમિટી | ૨૫૩૮૯૮૯૧ | ૬૧૨ | ૯૩૨૮૭૮૪૫૭૫ ૯૪૬૦૫૫૩૨૦ |
| શ્રી રમેશભાઈ આર. દેસાઈ રોડ્ઝ એન્ડ બિલ્ડિંગ કમિટી | ૨૫૩૮૯૮૯૧ | ૬૧૩ | ૯૩૨૮૭૮૪૬૬૮ |
| શ્રી પરેશભાઈ એચ. પટેલ હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી | ૨૫૩૮૯૮૯૧ | ૪૨૫ | ૯૯૨૫૦૨૨૧૮૫ ૯૮૬૦૦૪૮૮૦ |
| શ્રી દેવાંગભાઈ જે. દાણી હોસ્પિટલ કમિટી | ૨૫૩૮૯૮૯૧ | ૬૧૪ | ૯૮૧૯૮૭૦૫૪૪ ૯૪૬૩૦૨૫૨૦ |
| શ્રી જીજેશભાઈ એમ. પટેલ રોકી કલ્યારલ એન્ડ હેરીટેજ કમિટી | ૨૫૩૮૯૮૯૧ | ૬૧૬ | ૯૮૧૯૮૭૦૫૧૬ |
| શ્રી ગોતમભાઈ બી. પટેલ ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી | ૨૫૩૮૯૮૯૧ | ૬૩૭ | ૯૮૨૫૦૦૪૯૦૦ |
| શ્રી વલ્લભભાઈ કે. પટેલ હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇ. ડબલ્યુ.એસ. આવાસ યોજના કમિટી | ૨૫૩૮૯૮૯૧ | ૬૧૭ | ૯૩૨૭૪૨૬૦૮૦ |
| શ્રી ગોતમભાઈ એલ. કથીરીયા એવન્યુ કમિટી | ૨૫૩૮૯૮૯૧ | ૬૨૮ | ૯૩૨૮૭૮૪૫૬૨ ૯૮૨૫૩૮૨૮૫૨ |
| શ્રી રેણુકા એન. પટેલ લીગલ કમિટી | ૨૫૩૮૯૮૯૪ | ૭૪૩ | ૯૮૧૯૮૭૦૫૧૮ ૯૯૬૯૧૯૩૧૧૨ |
| શ્રી કૃષ્ણાવદન એસ. બહારહુ મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેજ કમિટી | ૨૫૩૮૯૮૯૧ | ૬૧૮ | ૯૩૨૮૭૮૪૬૧૩ ૯૩૨૭૪૨૬૦૦૪ |
| શ્રી પુષ્પાલેન ડી. મિશ્ની મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટી | ૨૫૩૮૯૮૯૧ | ૬૧૬ | ૯૩૨૭૪૨૬૧૧૮ ૯૯૮૪૭૩૨૪૮૧ |

પ્રકરણ-૧૭
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

તા. ૨-૫-૨૦૧૯ થી તા. ૧-૫-૨૦૨૦ દરમાન અમદાવાદ જલ્લામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું
બંધારણીય કામકાજ દર્શાવતું પત્રક (તા. ૧-૫-૨૦૨૦ ની સ્થિતિએ)

| | | | |
|------|---|---|--|
| ૧ | અનુક્રમ નંબર | : | ૧ |
| ૨ | મહાનગરપાલિકાનું નામ | : | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
| ૩ | જેના અન્વયે બંધારણ થયું હોય તે અવિનિયમ | : | ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુ.કોર્પો. એક્ટ-૧૯૪૮ |
| ૪ | નિયુક્ત બેઠકો સહિતની બેઠકોની કુલ સંખ્યા | : | ૧૯૨ |
| ૫ | (ક) નિયુક્ત કરેલ (ખ) મતદાર મંડળો (વિભાગ) દ્વારા ચૂંટાયેલા સંખ્યો | : | ૧૯૨ |
| ૬ | (ક) મહિલા અનામત (૧) સામાન્ય : ૭૬ (૨) અનુ. જાતિ : ૧૦ (૩) અનુ. આદિ જાતિ : ૦૧ (૪) પદ્ધત વર્ગ : ૦૮ કુલ : ૮૬ | : | ૮૬ |
| | (ખ) (૧) અનુ.જાતિ માટે અનામત બેઠકો (કુલ ૨૦ પૈકી ૧૦ મહિલા અનામત) (૨) પદ્ધત વર્ગ માટે અનામત બેઠકો (કુલ-૧૮ પૈકી ૮ મહિલા અનામત) | : | ૧૦ |
| | (ગ) આદિજાતિ માટે અનામત (કુલ-૨ પૈકી ૧ મહિલા અનામત) | : | ૧ |
| | | : | ૧૧૭ |
| ૭ | સામાન્ય બેઠકો | : | ૭૫ |
| ૮ | કુલ બેઠકો | : | ૧૯૨ |
| ૯ | યોજાયેલી કુલ બેઠકોની સંખ્યા : (તા. ૨-૫-૨૦૧૯ થી તા. ૧-૫-૨૦૨૦) | : | ૧૩ |
| ૧૦ એ | યોજાયેલી બેઠકો દરમાન નિકાલ કરેલ કામોની સંખ્યા (તા. ૨-૫-૨૦૧૯ થી તા. ૧-૫-૨૦૨૦) | | ૭૭૮ |

| | | |
|----|---|-------|
| ૧૦ | આસન-૮ માં કુલ બેઠકોમાંથી કાર્યસાધક સંખ્યા (કોરમ) : ના અભાવે નિષ્ફળ સાબિત થઈ હોય તેવી બેઠકોની સંખ્યા. | |
| ૧૧ | આસન-૮ માંથી કુલ બેઠકોમાંથી મુલતવી રાખવામાં આવી હોય તેવી બેઠકોની સંખ્યા. | ૧ |
| ૧૨ | દરેક બેઠકમાં હાજર હોય તેવા સત્યની સરેરાશ ટકાવારી | ૮૦.૮૬ |

પ્રકરણ-૧૭

ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

સને ૨-૫-૨૦૧૯ થી ૧-૫-૨૦૨૦ સુધીમાં મળેલ સ્ટેચ્યુટરી તથા સ્પેશીયલ કમિટીઓએ કરેલ કામગીરી નીચેના પત્રકમાં દર્શાવવામાં આવી છે.

| અ.નં. | કમિટીનું નામ | બેઠકની સંખ્યા | નિકાલ કરેલ કામોની સંખ્યા |
|-------|------------------|---------------|--------------------------|
| ૧. | સ્ટેન્ડિંગ કમિટી | ૪૯ | ૧૧૬૮ |

સ્પેશીયલ કમિટીઓ

| અ.નં. | કમિટીનું નામ | બેઠકની સંખ્યા | નિકાલ કરેલ કામોની |
|-------|--|---------------|-------------------|
| ૧. | વોટર સપ્લાય એન્ડ સુઆરેજ કમિટી | ૧૯ | ૨૧૦ |
| ૨. | રોડ્ઝ એન્ડ બિલ્ડિંગ કમિટી | ૨૦ | ૨૮૦ |
| ૩. | હોસ્પિટલ કમિટી | ૨૧ | ૬૪ |
| ૪. | લીગલ કમિટી | ૧૮ | ૨૭ |
| ૫. | સ્ટાફ સીલેક્શન એન્ડ એપો.કમિટી | ૫ | ૧૧ |
| ૬. | હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી | ૧૭ | ૧૫૩ |
| ૭. | ટાઉન પ્લાનીંગ એન્ડ ઓસ્ટેટ મેનેજમેન્ટ કમિટી | ૧૭ | ૭૬ |
| ૮. | હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઈ.ડબલ્યુ.આવાસ યોજના કમિટી | ૨૧ | ૨૧ |
| ૯. | રીકીએશન, કલ્યારલ એન્ડ હેરીટેજ કમિટી | ૨૩ | ૪૬ |
| ૧૦. | રેવન્યુ કમિટી | ૨૧ | ૩૩ |
| ૧૧. | મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી | ૧૯ | ૫૧ |
| ૧૨. | મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટી | ૨૩ | ૩૬ |

પ્રકરણ-૧૭
દરાવવામાં આવે તેવી બીજી માહિતી

તા.૨-૫-૨૦૧૯ થી તા.૧-૫-૨૦૨૦ દરમ્યાન મળેલ ખુનિસિપલ બોર્ડની મીટીગોમાં
કાઉન્સિલરશ્રીની સરેરાશ હાજરી

| અ.નં. | મીટીગની તારીખ | સંખ્ય સંખ્યા | કુલ સંખ્યા | ખાલી જગ્યા | હાજર સંખ્યા | હાજરીની ટકાવારી |
|-------|------------------------------------|-----------------|------------|---------------|-------------|--------------------|
| ૧. | ૨૮/૦૫/૨૦૧૯ | ૧૯૨ | ૧૯૨ | - | ૧૬૬ | ૮૬.૪૫ |
| ૨. | ૨૬/૦૩/૨૦૧૯ મુલતવી ૨૮/૦૫/૨૦૧૯ | ૧૯૨ | ૧૯૨ | - | ૧૬૬ | ૮૬.૪૫ |
| ૩. | ૨૮/૦૬/૨૦૧૯ | ૧૯૧ | ૧૯૧ | ૧ | ૧૮૦ | ૮૪.૨૪ |
| ૪. | ૩૦/૦૭/૨૦૧૯ | ૧૯૧ | ૧૯૧ | ૧ | ૧૭૬ | ૮૨.૧૪ |
| ૫. | ૩૦/૦૮/૨૦૧૯ | ૧૯૧ | ૧૯૧ | ૧ | ૧૭૩ | ૮૦.૫૭ |
| ૬. | ૩૦/૦૯/૨૦૧૯ | ૧૯૧ | ૧૯૧ | ૧ | ૧૬૨ | ૮૪.૮૧ |
| ૭. | ૨૩/૧૦/૨૦૧૯ | ૧૯૧ | ૧૯૧ | ૧ | ૧૮૩ | ૮૪.૮૧ |
| ૮. | ૨૭/૧૧/૨૦૧૯ | ૧૯૨ | ૧૯૨ | - | ૧૭૧ | ૮૮.૦૬ |
| ૯. | ૨૩/૧૨/૨૦૧૯ | ૧૯૨ | ૧૯૨ | - | ૧૭૨ | ૮૮.૫૮ |
| ૧૦. | ૨૮/૦૧/૨૦૨૦ | ૧૯૨ | ૧૯૨ | - | ૧૬૩ | ૮૪.૮૮ |
| ૧૧. | ૧૭/૦૨/૨૦૨૦ | ૧૯૨ | ૧૯૨ | - | ૧૬૦ | ૮૮.૮૫ |
| ૧૨. | ૧૭/૦૨/૨૦૨૦ મુલતવી ૧૮/૦૨/૨૦૨૦ | ૧૯૨ | ૧૯૨ | - | ૧૬૦ | ૮૮.૮૫ |
| ૧૩. | ૨૮/૦૨/૨૦૨૦ | ૧૯૨ | ૧૯૨ | - | ૧૭૪ | ૮૦.૬૨ |
| * | માર્ચ - ૨૦૨૦ મીટીગ મળેલ નથી | | | | | |
| * | એપ્રિલ - ૨૦૨૦ મીટીગ મળેલ નથી | | | | | |
| | | ૨૪૯૧ | | | ૨૨૬૬ | ૮૦.૮૬ |

* કોરોના વાઈરસ ની મહામારી ના કારણે લોકડાઉન હોવા થી માર્ચ - ૨૦૨૦ ની મીટીગ મોકુફરાખેલ તથા એપ્રિલ - ૨૦૨૦ ની મીટીગ મળેલ નથી.

પ્રકરણ-૧૭

ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

નામદાર ગુજરાત સરકારશ્રીના તા.૦૧-૧૦-૨૦૧૮ના ઠરાવ ક્રમાંક AMN/૧૦૨૦૧૮/૬૪૨૧/P થી મળેલ મંજુરી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલ મ્યુ. કાઉન્સીલરશ્રીઓને નીચે જણાવેલ વિગતે માનદ વેતન, મિટીગ એલાઉન્સ, સ્ટેશનરી એલાઉન્સ, ટેલીફોન એલાઉન્સ ચુકવવામાં આવે છે.

- (૧) માનદ વેતન(ઓનરેરીયમ)માસિક રૂ. ૧૨,૦૦૦/- (અંકે રૂપીયા બાર હજાર પુરા) ચુકવવામાં આવે છે.
- (૨) મ્યુ. બોર્ડની બેઠક, સ્ટેન્ડીગ કમિટી તથા અન્ય સ્પે. કમિટીઓની મિટીગમાં હાજર રહે તો તે પ્રત્યેક મિટીગ દીઠ રૂ.૫૦૦/- (અંકે રૂપીયા પાંચસો પુરા) લેખે મિટીગ એલાઉન્સ ચુકવવામાં આવે છે.
- (૩) ટેલીફોન એલાઉન્સ પેટે માસિક રૂ. ૧૦૦૦/- (અંકે રૂપીયા એક હજાર પુરા) ચુકવવામાં આવે છે.
- (૪) સ્ટેશનરી એલાઉન્સ પેટે માસિક રૂ. ૧૫૦૦/- (અંકે રૂપીયા એક હજાર પાંચસો પુરા) ચુકવવામાં આવે છે.
- (૫) મ્યુનિસિપલ કમિશનરશ્રીના તા.૩૦-૧-૨૦૧૭ના સરક્યુલર અનુસાર નક્કી થયેલ મોબાઈલ પોલીસી મુજબ દરેક ચૂંટાયેલ મ્યુનિ. કાઉન્સીલરશ્રીઓને ૨.૫ વર્ષે મોબાઈલ ઇન્સ્ટ્રોમેન્ટની ખરીદી પેટે તેઓ દ્વારા બિલ/વાઉચર રજૂ થયેથી રૂ. ૧૨,૦૦૦/- (અંકે રૂપીયા બાર હજાર પુરા) ની મર્યાદામાં રીટર્ન મેન્ટ કરી આપવામાં આવે છે.
- (૬) સ્ટે.ક.ઠ.નં. ૭૦૫ તા.૨૧-૦૮-૨૦૦૧ તથા મ્યુ.કોર્પો. ઠ.નં. ૫૨૦ તા. ૨૩-૧૦-૨૦૦૧ના અનુસંધાને સ્ટે.ક.ઠ.નં. ૮૭૨ તા.૧૭-૦૮-૨૦૦૭ અનુસાર નક્કી થયેલ નીતિ અનુસાર ચૂંટાયેલ મ્યુ. કાઉન્સીલરશ્રીઓને દર વર્ષ સ્ટેશનરી છપાવીને આપવામાં આવે છે જે અનુસાર સ્ટે કમિટી ઠ.નં.૮૫૭ તા.૧૦/૦૧/૨૦૨૦ થી મળેલ મંજુરી મુજબ વર્ષ ૨૦૧૫-૨૦૨૦ની ટર્મના પાંચમાં વર્ષ માટે ૧૨ (બાર) પેડની મર્યાદામાં સ્ટેશનરી છપાવીને આપવામાં આવેલ છે. તથા પેન સેટ આપવામાં આવેલ છે.
- (૭) સ્ટે.ક.ઠ.નં. ૩૭૮ તા.૧૦-૦૫-૧૯૭૮ તથા મ્યુ.કોર્પો. ઠ.નં. ૨૭૬ તા.૧૮-૭-૧૯૭૮થી નક્કી થયેલ સામાન્ય નીતિ તથા ત્યારબાદ વખતો વખત સ્ટેન્ડીગ કમિટી તથા મ્યુ.કોર્પો.ના ઠરાવો અનુસાર મ્યુ.કોર્પો. સંચાલિત હોસ્પિટલમાં મ્યુ.કાઉન્સીલરશ્રીઓને તથા તેમના કુટુંબીજનોને વિનામુલ્યે વૈદકીય સારવારના લાભો આપવામાં આવે છે.